#059
😃 આ ખરી ધુળેટી

ધુળેટી માત્ર રંગોનો તહેવાર નથી…
તે તો દિલોને રંગવાનો દિવસ છે.
Holi પછી આવતી ધુળેટી આપણને એક મોટો સંદેશ આપે છે —
ગઈકાલે અગ્નિમાં અહંકાર બળ્યો, અને આજે સંબંધો રંગાઈ રહ્યા છે.

જીવનમાં ક્યારેક મન સુકાઈ જાય છે…
સંબંધોમાં ધૂળ જમા થઈ જાય છે…
અહંકાર, ગેરસમજ અને ઈર્ષ્યા હૃદયને ફીકા બનાવી દે છે.

ધુળેટી કહે છે —
“રંગ ઉડાડતા પહેલા મનનો ભાર ઉતારી દો.”
કોઈને માફ કરી દો…
કોઈને ગળે લગાવી દો…
કોઈ સાથે ફરીથી મિત્રતા શરૂ કરી દો…

રંગો આપણને શીખવે છે —
લાલ ઉત્સાહ, પીળો આનંદ, લીલો વિકાસ અને વાદળી શાંતિ.
જીવન પણ એવું જ છે — જેટલા રંગો ઉમેરીશું, એ એટલું વધુ સુંદર બનશે.

ચાલો આજની ધુળેટીએ નક્કી કરીએ—
હું મારા જીવનને ખુશીના રંગોથી રંગીશ,
અને બીજા લોકોના જીવનમાં પણ આનંદનો એક રંગ જરૂર ઉમેરીશ.

કારણ કે સાચી ધુળેટી એ છે —
જ્યારે ચહેરા પર નહીં, દિલ પર રંગ ચઢે.
Happiee Dhuleti